

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

તા. ૨૨/૦૧/૨૦૧૮ થી તા. ૨૫/૦૧/૨૦૧૮ તેમજ તા. ૨૯/૦૧/૨૦૧૮ તથા તા. ૩૦/૦૧/૨૦૧૮ દરમ્યાન મંડળ દ્વારા યોજવામાં આવનાર કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ અંગેની સુચનાઓ તા. ૨૧/૧૨/૨૦૧૭ ના રોજ મંડળની વેબ સાઇટ પર મુકવામાં આવેલ છે. તેના અનુસંધાને ઉક્ત પરીક્ષાના પ્રશ્નપત્ર સંદર્ભે કેટલાક ફેરફારો સાથેની વિશેષ સુચનાઓ ઉમેદવારોના ધ્યાને મુકવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.

(૧) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર

જા.ક. ૧૦૩/૨૦૧૬૧૭, ૧૦૪/૨૦૧૬૧૭, ૧૦૬/૨૦૧૬૧૭, ૧૧૦/૨૦૧૬૧૭, ૧૨૦/૨૦૧૬૧૭, ૧૨૨/૨૦૧૬૧૭, ૧૨૮/૨૦૧૬૧૭, ૧૨૯/૨૦૧૬૧૭, ૧૩૦/૨૦૧૬૧૭, ૧૩૫/૨૦૧૭૧૮, ૧૩૬/૨૦૧૭૧૮, ૧૩૭/૨૦૧૭૧૮ - માટે

સમય - ૧-૧૫ કલાક		
પ્રશ્ન ક્રમાંક	વિષયનું વિવરણ	ગુણ
૧	એક્સેલ સ્પ્રેડશીટ	૧૫ ગુણ
૨	વર્ડ ફોર્મેટીંગ (અંગ્રેજી)	૨૦ ગુણ
૩	પાવર પોઇન્ટ	૧૫ ગુણ
૪	ગુજરાતી ટાઇપીંગ	૧૦ ગુણ
૫	ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટેચમેન્ટ)	૧૫ ગુણ
	કુલ ગુણ	૭૫ ગુણ

નોંધ:-

પ્રશ્ન ક્રમાંક- ૧ અંગ્રેજી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે

પ્રશ્ન ક્રમાંક- ૨ અંગ્રેજી ભાષામાં સોફ્ટ કોપીમાં રહેશે પરંતુ વર્ડ ફોર્મેટીંગના કમાન્ડ હાર્ડ કોપીમાં રહેશે.

પ્રશ્ન ક્રમાંક- ૩ અંગ્રેજી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે

પ્રશ્ન ક્રમાંક- ૪ ગુજરાતી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે.

પ્રશ્ન ક્રમાંક- ૫ અંગ્રેજી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે પરંતુ ફાઇલ એટેચમેન્ટ સોફ્ટ કોપીમાં રહેશે.

(૨) આ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ - ૨૦૦૭ ના વર્ઝન (Version) માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતિ અને માઇક્રોસોફ્ટ ઇન્ડીક લેંગ્વેજ ઇનપુટ ટુલ- ૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે દર્શાવ્યા મુજબના જુદા જુદા ૮ પ્રકારના કી-બોર્ડ ઉપલબ્ધ છે.

1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Gujarati Indica
6. Remigntan Indica
7. Special Characters.
8. Gujarati Terafont

(૩) વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઇલ) ની પરીક્ષા સોફ્ટવેર દ્વારા ખોલી આપવામાં આવેલ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઇલ) માં જ આપવાની રહેશે. વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઇલ) પરીક્ષામાં ઉમેદવારે કોઈ ફાઇલ બનાવવાની રહેશે નહીં. એ ફાઇલ સોફ્ટવેર દ્વારા ઓટોમેટીક બનશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષાના સોફ્ટવેર સિવાય ફાઇલ ઓપન કરી લખશે તો ઉમેદવારનું પરીણામ માન્ય ગણાશે નહીં.

(૪) ઉમેદવારને કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર મંડળ તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારને પોતાનું કી બોર્ડ લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી શરૂ થતાં પહેલા અને પરીક્ષા મંડમાં પ્રવેશ્યા બાદ આપને ફાળવેલ કોમ્પ્યુટર કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર બરાબર ચાલે છે તેની ખાત્રી કરી લેવાની રહેશે.

(૫) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી સમયે કોમ્પ્યુટરમાં કોઈ ટેકનીકલ ખામી જણાય તો ઉમેદવારે અન્ય ઉમેદવારને ખલેલ પહોંચાડ્યા વગર તેમજ પોતે કોઈ પગલાંઓ લીધા વગર પોતાનું સ્થાન જાળવી રાખીને (ઉભા થયા વગર) વર્ગ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને જાણ કરવાની રહેશે.

(૬) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે એક જ વાર “ Log in “ થઇ શકાશે. પરીક્ષાનો સમય ૧-૧૫ કલાક પૂરો થયા પહેલા ઉમેદવાર પોતે “ Submit “ કરી દેશે. તો ફરીથી “ Log in “ થઇ શકશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો સમય ૧-૧૫ કલાક બાદ સમય પૂર્ણ થવાના કારણે ટાઇપ થવાનું આપોઆપ બંધ થઇ જશે. એ સમય પહેલા જો ઉમેદવાર Confirm / Accept કરીને તેમનું ટાઇપ કામ સબમીટ (Submit) કરી દેશે તો તે પછી ટાઇપ કામ થઇ શકશે નહીં.

(૭) પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક ૧ થી ૪ અંતર્ગત તેના જવાબ માં કરવામાં આવેલ ભૂલો જેવી કે, સ્પેલીંગ / જોડણીની ભૂલ, માર્જિન સેટીંગ, ફોન્ટ સાઇઝ, ટાઇપકામ ની ભૂલ બાબતે માર્કિંગ મંડળના નિર્ણય અનુસાર કરવામાં આવશે.

(૮) આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર

કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (**Minimum qualifying marks**) નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.

- (૯) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું પરિણામ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ આધારીત હોઈ, તેના રીચેકીંગ અંગેની અરજી ધ્યાને લેવામાં આવશે નહિં.

સ્થળ:- ગાંધીનગર
તા. ૦૨/૦૧/૨૦૧૮

સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગર